

L.L.B. Semester - 3 (CBCS) Examination
Oct/Nov. – 2019 (Old Course)
BANKING LAW (ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ બેન્કની વ્યાખ્યા આપી અને તેના કાર્યો જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૧ બેન્કર અને ગ્રાહક વચ્ચેના સંબંધ સામાન્ય લેણદાર, દેવાદારના સંબંધોથી કઈ રીતે જુદા પડે છે?
- પ્રશ્ન-૨ રિઝર્વ બેન્કની સત્તા અને તેના કાર્યો જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૨ “લીયન અને સેટ ઓફ” બાબતે બેન્કોના અધિકાર સમજાવો.
- પ્રશ્ન-૩ વિનિમય પત્રની વ્યાખ્યા આપો અને તેના આવશ્યક તત્વો જણાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૩ વચનચિઠ્ઠી એટલે શું? વચનચિઠ્ઠી અને વિનિમયપત્ર વચ્ચેનો તફાવત સમજાવો.
- પ્રશ્ન-૪ પરાક્રમ્પ લેખ ઉપર કરવામા આવતા વિવિધ શેરાઓ અને તેની જોગવાઈઓ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૪ યથાનુક્રમે ધારણ કરનાર વ્યાખ્યા આપી તેના અધિકારોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- (1) ગાર્નિશી ઓર્ડર
 - (2) ચેકનો અનાદર
 - (3) પરાક્રમ્પ લેખ
 - (4) પરીપકવતા અને છુટના દિવસો (કલમ – ૨૨)

English Version

- Q-1 Define the bank and its functions. (14)
 OR
- Q-1 How the relation of creditor – debtor can be distinguished from the banker and customer?
- Q-2 Explain the powers and functions of reserve bank of India. (14)
 OR
- Q-2 Explain the bankers right to “Lien and set off”.
- Q-3 Define the bill of exchange and discuss its essentials. (14)
 OR
- Q-3 Define promissory note. State the difference between promising note and bill of exchange.
- Q-4 State the different kinds of endorsements made on the instrument and its provisions. (14)
 OR
- Q-4 Define the holder in due – course. What are the rights of holder. In due course?
- Q-5 Write a short note : (Any two) (14)
- (1) Garnishee order
 - (2) Dishonour of Cheque
 - (3) Negotiable instrument
 - (4) Maturity and days of Grace (Sec. 22)
